

ક્લિફ્ટન હોમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે

1. ફૂપા કરીને બધી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને તેનું પાલન કરો
2. અરજીઓનાં 1-7 પેજ અને લીડ આધારિત પેઇન્ટ સૂચના ભરો, સહી કરો અને પરત કરો. કુલ આવકનો પુરાવો અને તમામ માલિકો અને કુટુંબના સભ્યો માટે માલિકીનો પુરાવો અરજીઓ સાથે સબમિટ કરવો આવશ્યક છે
3. હાઉસિંગ ઇન્સ્પેક્ટર કોઈપણ શહેરના હાઉસિંગ કોડના ઉલ્લંઘન માટે તમારા ઘરનું નિરીક્ષણ કરશે. નિરીક્ષક ઉલ્લંઘનને કેવી રીતે સુધારવું તે સમજાવશે. તમને એક નિરીક્ષણ અહેવાલ અને નોકરીની વિશિષ્ટતાઓ પ્રાપ્ત થશે.
તમારા કામ પર બોલી લગાવતા કોન્ટ્રાક્ટરોને જોબ સ્પેસિફિકેશન્સ આપવાના છે. આ સુનિશ્ચિત કરશે કે તમારા ત્રણેય (3) અંદાજ કામના અવકાશ અને ઉપયોગમાં લેવાતી સામગ્રીને અનુરૂપ સુસંગત છે.
4. તમારે દરેક કામની આઇટમ માટે ત્રણ (3) લેખિત અંદાજ પ્રાપ્ત કરવા આવશ્યક છે. નિરીક્ષણ હાથ ધરવામાં આવે તે પહેલાં અંદાજો સ્વીકારવામાં આવશે નહીં. જ્યાં સુધી તમારી પાસે ઉલ્લંઘન પત્ર અને નોકરીની વિશિષ્ટતાઓ ન હોય ત્યાં સુધી અંદાજ ન મેળવો.
5. તમામ અંદાજો આ ઓફિસમાં સબમિટ કરો
6. તમારે સૌથી ઓછી કિંમતના કોન્ટ્રાક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે સૌથી ઓછી બોલી લગાવનાર સિવાય અન્ય કોઈનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો, તો ઘરમાલિકે તફાવત ચૂકવવો પડશે.
7. ખર્ચ અંદાજકારો તમારા ઘર પર કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર સાથે મુલાકાત કરશે.
8. અંદાજ મંજૂર થયા પછી, તમારે અંદાજિત શરૂઆત અને સમાપ્તિ તારીખો મેળવવાની રહેશે અને તે આ ઓફિસને પ્રદાન કરવી પડશે.
9. તમને CHIP કોન્ટ્રાક્ટ્સ લેવા માટે જાણ કરવામાં આવશે, એટલે કે, નોંધ, ગીરો, બાંધકામ કરાર, મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ અને ચુકવણી માટેની વિનંતી, બધા દસ્તાવેજો જ્યાં સૂચવવામાં આવ્યા છે ત્યાં સહી કરી અને નોટરાઈઝ કરવામાં આવશે અને તે અમને પરત કરવાના રહેશે. કોન્ટ્રાક્ટર ક્યારે શરૂ કરી શકશે તે અંગે અમે તમને જાણ કરીશું.

10. એકવાર કોન્ટ્રાક્ટર કામ કરવાનું શરૂ કરે, જ્યારે કામ 1/3 પૂર્ણ થાય, ફરીથી જ્યારે કામ 2/3 પૂર્ણ થાય અને પૂર્ણ થઈ જાય ત્યારે અમને જાણ કરો. દરેક ચુકવણી પહેલાં તપાસ કરવામાં આવશે. જ્યાં સુધી કોડના તમામ ઉલ્લંઘનોને સુધારવામાં ન આવે ત્યાં સુધી ઘરમાલિકને અંતિમ ચુકવણી કરવામાં આવશે નહીં.

11. મકાનમાલિકને ચુકવણી નીચે મુજબ કરવામાં આવશે:
1/3 જ્યારે સામગ્રીનો 1/3 ભાગ યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે
1/3 જ્યારે સામગ્રીનો 2/3 ભાગ ઇન્સ્ટોલ કરવામાં આવે
અંતિમ વિલંબિત ચુકવણી લોન ચુકવણી કામ પૂર્ણ થવા પર અને તમામ નિરીક્ષણો પસાર કર્યા પછી.

ચકાસણીના ત્રીસ (30) દિવસમાં ચુકવણી કરવામાં આવશે.

જો તમને કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને અમને 470-5848 પર નિઃસંકોચ કોલ કરો

12. મહત્તમ સ્થગિત ચુકવણી લોનની રકમ \$10,000.00 છે. કોઈપણ 10,000.00 ડોલરથી વધુનો પુનર્વસન ખર્ચ મિલકતના માલિક દ્વારા ચુકવવો આવશ્યક છે.

પાત્રતા જરૂરીયાતો અને માર્ગદર્શિકા

- 1-3 એકમોના માલિકના કબજામાં રહેલ આવાસ.
- કોઈ વ્યાપારી અથવા ઔદ્યોગિક માળખાં નથી.
- માળખાંને સુધારવા માટે વિલંબિત ચુકવણી લોન મળી શકે છે હાઉસિંગ કોડના ઉલ્લંઘનો "માત્ર", કોઈ રિમોડેલિંગને મંજૂરી આપવામાં આવશે નહીં.
- મિશ્ર ઉપયોગના કિસ્સામાં, અન્ય પાત્ર રહેણાંક માળખાંને લાગુ પડતા માર્ગદર્શિકા મુજબ માત્ર રહેણાંક ભાગ જ પાત્ર છે.
- વિલંબિત ચુકવણી: લોન મેળવનારાઓએ ભંડોળની ચુકવણી પછી છ (6) વર્ષ સુધી માલિકના કબજા હેઠળના માળખાંમાં રહેવા માટે સંમત થવું જોઈએ અને ભંડોળની ચુકવણી પછી છ (6) વર્ષ સુધી પુનર્વસન કરાયેલ માળખું ન વેચવા માટે સંમત થવું જોઈએ.
- આવકની જરૂરિયાતો કુલ આવક પર આધારિત છે (તમામ કરપાત્ર અને તમામ બિન-કરપાત્ર આવક) અને કૌટુંબિક કદ પર ભારિત છે. જો તમારી કુલ આવક નીચે આપેલા ચાર્ટમાં સૂચિબદ્ધ મર્યાદામાં હોય તો તમે પાત્ર છો.

	એક	બે	ત્રણ	ચાર
કુટુંબનું કદ	\$72,600	\$83,000	\$93,350	\$103,700
	પાંચ	છ	સાત	આઠ
કુટુંબનું કદ	\$112,000	\$120,300	\$128,600	\$136,900
- લોન પ્રાપ્તકર્તાએ પુનર્વસવાટ કરાયેલ માળખાંમાં (કાનૂની કારણ સિવાય) કોઈપણ ભાડૂતને બહાર ન કાઢવાની અને ઓછામાં ઓછા બે (2) વર્ષની લીઝ સાથે સતત ભાડૂત ઓફર કરવા માટેની પ્રોગ્રામ નીતિ સાથે સંમત થવું આવશ્યક છે.
- લોન મેળવનાર ભાડૂત(ભાડૂતો)નું ભાડું દર વર્ષે દસ (10%) ટકા કરતા વધારે વધારી શકતા નથી, (ભાડૂત(ભાડૂતો)ના ભાડાના આધારે ભંડોળ ચૂકવ્યા પછી ઓછામાં ઓછા બે (2) વર્ષ સુધી પુનર્વસન શરૂ થાય તે પહેલાં).
- પ્રાપ્તકર્તા તમામ સિટી બિલ્ડિંગ અને હાઉસિંગ વટહુકમ કે જે લાગુ થાય છે તે મુજબ હોવા જોઈએ.
- પ્રાપ્તકર્તાએ પુનર્વસન કાર્ય સાથે જોડાણમાં કોડના ધોરણો સુધી માળખું લાવવા માટે સંમત થવું આવશ્યક છે. શહેર દ્વારા કોઈપણ ચિપ ફંડ રિલીઝ થાય તે પહેલાં તમામ ઉલ્લંઘનો સમારકામ માટે કરાર હેઠળ હોવા જોઈએ.
- પુનર્વસનની મૂળભૂત રચનામાં કોઈ ઉમેરો નથી

વિલંબિત ચુકવણી લોનની રકમ સાથે બિલ્ડિંગના બાંધકામની મંજૂરી આપવામાં આવશે.

12. કોન્ટ્રાક્ટરે અનુદાન પ્રાપ્તકર્તા સાથે કરાર પર હસ્તાક્ષર કરવા આવશ્યક છે

જેમાં પ્રોગ્રામ નીતિઓનું પાલન કરવાની જોગવાઈ ઉપરાંત લેખન, ખર્ચ અંદાજ અને ચુકવણી શેડ્યૂલનો સમાવેશ થાય છે.

13. આયોજિત પુનર્વસન CHIP દ્વારા આર્થિક રીતે શક્ય હોવાનું નિર્ધારિત કરવું જોઈએ.

14. CHIP ફંડ્સ સાથે પુનર્વસન કરાયેલ તમામ મિલકતો અંતિમ ચુકવણીની તારીખથી શરૂ થતા છ (6) વર્ષના ગીરો સાથે બોજો રહેશે.

15. માલિક/મિલકત દીઠ માત્ર એક (1) વિલંબિત ચુકવણી લોન.

16. જો પૂરના સંકટ, વિસ્તારોમાં સ્થિત સૌથી તાજેતરના સંઘીય વીમા દરના નકશા પર સહાયક માળખું ઓળખવામાં આવે તો, "નોંધ" ના સમયગાળા માટે પૂર વીમો ખરીદવો આવશ્યક છે.

17. જો સૂચિત કાર્યની કિંમત સિટી તરફથી વિલંબિત ચુકવણી લોન કરતાં વધુ હોય, તો મકાનમાલિકે સિટીને દર્શાવવું આવશ્યક છે કે તેઓ વધારાની કિંમત પોતાની જાતે અથવા ખાનગી ધિરાણ દ્વારા ચૂકવી શકે છે, આવા તમામ કિસ્સાઓમાં, શહેર કોઈપણ ચુકવણી બહાર પાડે તે પહેલાં મકાનમાલિક તેમના ખર્ચનો હિસ્સો ચૂકવશે.

કિલફ્ટન હોમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ
સિટી હોલ (હાઉસિંગ વિભાગ)
900 કિલફ્ટોન એવન્યુ
કિલફ્ટોન, ન્યૂ જર્સી 07013
(973) 470-5847

સંભવિત લોન અરજદારનું માહિતી પત્રક

*કૃપા કરીને IRS ફોર્મ 1040 ની નકલ અને માલિકીનો પુરાવો (ડીડની નકલ) સબમિટ કરો
અરજીઓ સાથે

તારીખ _____

માલિકનું નામ _____

પુનર્વસન કરવા માટેની મિલકતનું સરનામું _____

બ્લોક _____ લોટ _____

માલિકનું સરનામું _____

ફોન નંબર _____ ઈ-મેલ સરનામું _____

માલિકની આવક \$ _____ સોશિયલ સિક્યુરિટી #

કુટુંબનું કદ _____

*વંશીય શ્રેણીઓ:

કૃપા કરીને નીચેનામાંથી એક ચેક કરો,

હિસ્પેનિક અથવા લેટિનો _____

હિસ્પેનિક અથવા લેટિનો નથી _____

*વંશીય શ્રેણીઓ:

કૃપા કરીને લાગુ પડે છે તે બધાને ચેક કરો,

અમેરિકન ભારતીય / અલાસ્કન મૂળ _____

એશિયન _____

કાળા અથવા આફ્રિકન અમેરિકન _____

ગોરા _____

મૂળ હવાઇયન અથવા અન્ય પેસિફિક આઇલેન્ડર _____

વરિષ્ઠ નાગરિક _____

વિકલાંગ _____

ઘરની મુખ્ય મહિલા _____

*વધુ માહિતી માટે, જોડાયેલ જાતિ અને વંશીય ડેટા રિપોર્ટિંગ સમજૂતીઓ જુઓ.

મિલકતનું વર્ણન

એકમોની સંખ્યા _____ લોટનું કદ _____

બિલ્ડિંગનું કદ _____ ચોરસ ફીટ. મકાનનો પ્રકાર _____

સામગ્રી _____ બિલ્ડિંગની તારીખ _____
ફેમ, ઈંટ, વગેરે.

1^{લા} માળે રૂમની સંખ્યા _____ બાથ _____

2^{જો}. માળ _____ બાથ _____

3^{જો}. માળ _____ બાથ _____

ગરમીનો પ્રકાર _____
વરાળ, ગરમ હવા, ગરમ પાણી, ઇલેક્ટ્રિક

ઈંધણનો પ્રકાર

_____ કોલસો, ગેસ, તેલ, ઇલેક્ટ્રિક

ગેરેજ _____ જોડાયેલ _____ અલગ કરેલ _____

મૂલ્યાંકન કરેલ મૂલ્ય: જમીન _____ મકાન _____ કુલ _____

ખરીદેલી કિંમત: \$ _____ તારીખ _____ કુલ _____

પુનર્વસનનું વર્ણન _____

વર્તમાન પૂર્વાધિકાર

પ્રથમ ગીરો _____ રકમ _____ ધારણ કરનાર _____

બીજો ગીરો _____ રકમ _____ ધારણ કરનાર _____

ભાડૂઆત દ્વારા પૂર્ણ કરીને આ ઓફિસમાં પરત કરવા.

તમારા મકાનમાલિકે તમે જે મકાનમાં રહો છો તેના સમારકામમાં સહાય માટે આ ઓફિસમાં અરજી કરી છે. આ એપ્લિકેશન પર પ્રક્રિયા કરવા માટે; અમારી પાસે નીચેની માહિતી હોવી આવશ્યક છે.

કૃપા કરીને નીચેનાનો જવાબ આપો અને પૂર્ણ થયેલ ફોર્મ પરત કરો:

ક્લિફ્ટન હોમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ
સિટી હોલ
૯૦૦ ક્લિફ્ટોન એવન્યુ
ક્લિફ્ટોન, ન્યૂ જર્સી ૦૭૦૧૩

તમારો જવાબ ગુપ્ત રાખવામાં આવશે. જો તમને કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને અમને ૪૭૦-૫૮૪૭ પર નિઃસંકોચ કોલ કરો

એપા. # _____ ફ્લોર લેવલ _____

કુટુંબમાં લોકોની સંખ્યા 1 ___ 2 ___ 3 ___ 4 ___ 5 ___ 6 ___ 7 ___ 8 ___ 9 ___ 10 ___

ઘરનો પ્રકાર (લાગુ થતા બધાને ચેક કરો)

હિસ્પેનિક _____ હિસ્પેનિક નથી _____
વરિષ્ઠ નાગરિક _____ સ્ત્રી વડા _____ વિકલાંગ _____ ગોરા _____ કાળા અથવા
આફ્રિકન અમેરિકન _____
એશિયન અથવા પેસિફિક આઇલેન્ડર _____ અમેરિકન ભારતીય / અલાસ્કન મૂળ _____

કુટુંબના કદ પ્રમાણે આવક:

કૌટુંબિક મથાળામાં નંબર હેઠળ લાગુ કુલ આવકની બાજુમાં કૃપા કરીને “X” મૂકો

પરિવારમાં લોકોની સંખ્યા:

<u>એક</u>	<u>બે</u>	<u>ત્રણ</u>
\$45,400 હેઠળ	\$51,850 હેઠળ	\$58,350 હેઠળ
\$72,600 હેઠળ	\$83,000 હેઠળ	\$93,350 હેઠળ
\$72,600 થી વધુ	\$83,000 થી વધુ	\$93,350 થી વધુ
<u>ચાર</u>	<u>પાંચ</u>	<u>છ</u>
\$64,800 હેઠળ	\$70,000 હેઠળ	\$75,200 હેઠળ
\$103,700 હેઠળ	\$112,000 હેઠળ	\$120,300 હેઠળ
\$103,700 થી વધુ	\$112,000 થી વધુ	\$120,300 થી વધુ
<u>સાત</u>	<u>આઠ</u>	
\$80,400 હેઠળ	\$85,500 હેઠળ	
\$128,600 હેઠળ	\$136,900 હેઠળ	
\$128,600 થી વધુ	\$136,900 થી વધુ	

હું પ્રમાણિત કરું છું કે ઉપરોક્ત માહિતી સાચી છે

નામ _____ સહી _____

તારીખ _____

મકાનમાલિકનું નામ _____

મકાનમાલિકનું સરનામું _____

કૃપા કરીને તમામ બોક્સમાંની બધી આઇટમ માટે "હા" અથવા "ના" નો જવાબ આપો અને એપ્લિકેશન સાથે "હા" ચિહ્નિત દરેક આઇટમના પુરાવા સાથે પરત કરો.

- _____ શું આજ સુધીના કર ચૂકવ્યા છે?
- _____ ફક્ત તમારા નામે ધર
- _____ તમારી સાથે રહેતા પરિવારના અન્ય સભ્યો
- _____ તમારી સાથે રહેતા બિન-પરિવારના સભ્યો
- _____ શું બાળકો કામ કરે છે (જો હા, આવકનો પુરાવો જરૂરી છે)
- _____ છેલ્લા વર્ષનું આઇઆરએસ 1040 ફોર્મ.
- _____ સોશિયલ સિક્યુરિટી (એવોર્ડ લેટર) પ્રાપ્ત કરવી
- _____ પેન્શન પ્રાપ્ત કરવું (પત્ર અથવા ચેકની નકલ)
- _____ બેંક વ્યાજ
- _____ કલ્યાણ મેળવવું
- _____ કોઈપણ અન્ય આવક (કરપાત્ર અથવા બિન-કરપાત્ર)
- _____ પરિવારના સભ્યો અથવા તમારી સાથે રહેતા બિન-પરિવારના સભ્યો
- _____ અથવા જેમના નામ ડીડ પર છે તેમની તમામ આવક
- _____ ભાડૂત પાસેથી ભાડું (બે કુટુંબનું ધર "માત્ર") મેળવવું, ભાડાની ચૂકવણીની રકમ દર્શાવતો પત્ર)
- _____ ગીરો ચુકવણી (ચુકવણી કાર્ડની નકલ)
- _____ સિટી પ્રોપર્ટી ટેક્સ બિલ (જો ગીરો ચુકવણીમાં શામેલ ન હોય તો)
- _____ કુલ સામાહિક અથવા દ્વિ-સામાહિક આવક દર્શાવતો એમ્પ્લોયર તરફથી પત્ર

તારીખ

સહી

H.U.D

C.D.

પેજ 5

કિલફટન હોમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ

કિલફટોન સિટી હોલ
900 કિલફટોન એવન્યુ, કિલફટોન, એનજી. 07013

બ્રાયન રોજર્સ
પ્રોગ્રામ એડમિનિસ્ટ્રેશન
ઇન્સ્પેક્ટર/કોસ્ટ એસ્ટિમેટર

હું, _____

_____, કિલફટન, N.J. ખાતે રહું છું.

આથી પ્રમાણિત કરું છું કે મેં આ સરનામે અથવા

અન્ય કોઈ સરનામે કિલફટન હોમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ

હેઠળ ક્યારેય લોન કે ગ્રાન્ટ પ્રાપ્ત કરી નથી.

સહી કરનાર _____

સહી કરનાર _____

મહેરબાની કરીને પુનર્વસન કરવામાં આવી રહેલી મિલકત પર રહેતા તમામ વ્યક્તિઓના નામની યાદી બનાવો.

1. _____
2. _____
3. _____
4. _____
5. _____
6. _____
7. _____
8. _____

મહેરબાની કરીને પુનર્વસન કરવા માટેની મિલકતના તમામ માલિકોના નામોની સૂચિ બનાવો.

1. _____
2. _____
3. _____
4. _____
5. _____
6. _____
7. _____
8. _____

C.D.

H.U.D.

કિલફટોન પબ્લિક હાઉસિંગ એજન્સી
કિલફટોન સિટી હોલ
900 કિલફટોન એવન્યુ . કિલફટોન, ન્યૂ જર્સી 07013
(973) 470-5847

સી. પી. એસ. સી. લીડ હેઝાર્ડ પેમ્ફલેટની પ્રાપ્તિની સ્વીકૃતિ

મને પેમ્ફલેટની એક નકલ મળી છે જેનું શીર્ષક છે "પ્રોટેક્ટ યોર ફેમિલી ફ્રોમ લીડ ઈન યોર હોમ"

નામ છાપો

સહી

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું પ્રોગ્રામ

કલિફોર્નિયા હોમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ

જાતિ અને વંશીય ડેટા રિપોર્ટિંગ સમજૂતીઓ

તમારે જે બે વંશીય શ્રેણીઓ પસંદ કરવી જોઈએ તે નીચે વ્યાખ્યાયિત કરવામાં આવી છે:

- હિસ્પેનિક અથવા લેટિનો.** જાતિને ધ્યાનમાં લીધા વિના ક્યુબન, મેક્સીકન, પ્યુર્ટો રિકન, દક્ષિણ અથવા મધ્ય અમેરિકન અથવા અન્ય સ્પેનિશ સંસ્કૃતિ અથવા મૂળની વ્યક્તિ. "હિસ્પેનિક" અથવા "લેટિનો" ઉપરાંત "સ્પેનિશ મૂળ" શબ્દનો ઉપયોગ થઈ શકે છે.
- હિસ્પેનિક અથવા લેટિનો નથી** જાતિને ધ્યાનમાં લીધા વિના ક્યુબન, મેક્સીકન, પ્યુર્ટો રિકન, દક્ષિણ અથવા મધ્ય અમેરિકન અથવા અન્ય સ્પેનિશ સંસ્કૃતિ અથવા મૂળની ન હોય તેવી વ્યક્તિ.

પસંદ કરવા માટે પાંચ વંશીય શ્રેણીઓ નીચે વ્યાખ્યાયિત કરવામાં આવી છે:

- અમેરિકન ભારતીય અથવા અલાસ્કાના વતની.** ઉત્તર અને દક્ષિણ અમેરિકા (મધ્ય અમેરિકા સહિત) ના કોઈપણ મૂળ લોકોમાંથી ઉદ્ભવેલી વ્યક્તિ અને જે આદિવાસી જોડાણ અથવા સમુદાય જોડાણ જાળવી રાખે છે.
- એશિયન.** ફાર ઇસ્ટ, દક્ષિણપૂર્વ એશિયા, અથવા ભારતીય ઉપખંડના મૂળ લોકોમાંના એકનું મૂળ, ઉદાહરણ તરીકે, કંબોડિયા, ચીન, ભારત, જાપાન, કોરિયા, મલેશિયા, પાકિસ્તાન, ફિલિપાઈન ટાપુઓ, થાઈલેન્ડ અને વિયેતનામ
- કાળા અથવા આફ્રિકન અમેરિકન.** આફ્રિકાના કોઈપણ કાળા વંશીય જૂથોમાં મૂળ ધરાવતી વ્યક્તિ. "બ્લેક" અથવા "આફ્રિકન અમેરિકન" ઉપરાંત "હેતીયન" અથવા "નેગ્રો" જેવા શબ્દોનો ઉપયોગ કરી શકાય છે.
- મૂળ હવાઇયન અથવા અન્ય પેસિફિક આઇલેન્ડર.** હવાઈ, ગુઆમ, સમોઆ અથવા અન્ય પેસિફિક ટાપુઓના મૂળ લોકોમાંથી કોઈપણમાં મૂળ ધરાવનાર વ્યક્તિ.
- ગોરા.** યુરોપ, મધ્ય પૂર્વ અથવા ઉત્તર આફ્રિકાના કોઈપણ મૂળ લોકોમાં મૂળ ધરાવતી વ્યક્તિ.

મકાનમાલિકને નોટિસ

ફોર્મની ત્રણ (૩) નકલો જોડવામાં આવી છે, જે કોઈપણને (એક) આપવાની છે

તમે જે કામ કરવાની યોજના ઘડી રહ્યા છો તેના માટે તમને લેખિત અંદાજ આપવા માટે તમે કરાર કર્યો છે

તે કોન્ટ્રાક્ટર. તમે તમારા ત્રણ (૩) અંદાજો સબમિટ કરો તે પહેલાં આ ફોર્મ દરેક કોન્ટ્રાક્ટરે ભરેલું હોવું જોઈએ અને અંદાજ સાથે જોડાયેલ હોવું જોઈએ.

કિલફટન હોમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ ઓફિસમાં

જ્યાં સુધી આ ફોર્મ જોડવામાં ન આવે ત્યાં સુધી અમારા સ્ટાફ દ્વારા કોઈ અંદાજ સ્વીકારવામાં આવશે નહીં.

જો કોઈ કારણોસર તમને વધારાના ખાલી ફોર્મની જરૂર હોય, તો કૃપા કરીને અમારી ઓફિસનો સંપર્ક કરો

અને અમે તમને મોકલીશું.

જ્યાં સુધી તમારી પાસે ઉલ્લંઘન પત્ર અને નોકરીની વિશિષ્ટતાઓ ન હોય ત્યાં સુધી અંદાજ ન મેળવો

કોન્ટ્રાક્ટરો અને મકાનમાલિકોને નોટિસ

આ અંદાજ સબમિટ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા તમારા અંદાજ ભરેલ, સહી કરેલ અને જોડાયેલ

હોવું આવશ્યક છે. આ ફોર્મ વિના સબમિટ કરેલ કોઈપણ અંદાજને માન્ય અંદાજ ગણવામાં આવશે નહીં

અને ક્લિફ્ટન હોમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ દ્વારા સ્વીકારવામાં

આવશે નહીં.

હું _____ આથી ના માલિક અથવા
[અંદાજ તૈયાર કરતી વ્યક્તિનું નામ] અહીં સહી સાથે અધિકૃત કર્મચારી તરીકે મારી સાથે

પ્રમાણિત કરું છું કે [મિલકતના માલિકનું નામ] _____
[અંદાજ ફોર્મ પર બતાવ્યા પ્રમાણે કંપનીનું નામ]

કે સાથે જોડાયેલ અંદાજ આપવામાં આવ્યો છે _____
[મિલકતના માલિકનું નામB]

પર સ્થિત મિલકત માટે _____
[મિલકતનું સરનામુંB]

ને આપવામાં આવેલો જોડાયેલ અંદાજ ઘરમાલિકને આપવામાં આવ્યો છે અને ઉપરોક્ત નામવાળી કંપની માટે માલિક અથવા અધિકૃત કર્મચારી તરીકે મારી સહી કરેલ છે.

હું પ્રમાણિત કરું છું કે મેં ક્લિફ્ટન હોમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ દ્વારા પ્રદાન કરેલ વર્કસાઇટ અને જોબ સ્પેસિફિકેશન્સ જોયા છે અને તમામ કામ જોબ સ્પેસિફિકેશન્સ અનુસાર કરવામાં આવશે. હું પ્રમાણિત કરું છું કે ઉપરોક્ત નિવેદનો મારી શ્રેષ્ઠ જાણ અને માન્યતા મુજબ સાચા અને સંપૂર્ણ છે. હું સમજું છું કે ખોટા નિવેદનો અથવા માહિતી ફેડરલ કાયદા હેઠળ સજાપાત્ર છે.

_____ [કોન્ટ્રાક્ટરની સહી]

_____ [તારીખ]

કોન્ટ્રાક્ટરો અને મકાનમાલિકોને નોટિસ

આ અંદાજ સબમિટ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા તમારા અંદાજ ભરેલ, સહી કરેલ અને જોડાયેલ

હોવું આવશ્યક છે. આ ફોર્મ વિના સબમિટ કરેલ કોઈપણ અંદાજને માન્ય અંદાજ ગણવામાં આવશે નહીં

અને ક્લિફ્ટન હોમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ દ્વારા સ્વીકારવામાં

આવશે નહીં.

હું _____ આથી ના માલિક અથવા
[અંદાજ તૈયાર કરતી વ્યક્તિનું નામ] અહીં સહી સાથે અધિકૃત કર્મચારી તરીકે મારી સાથે

પ્રમાણિત કરું છું કે [મિલકતના માલિકનું નામ] _____
[અંદાજ ફોર્મ પર બતાવ્યા પ્રમાણે કંપનીનું નામ]

કે સાથે જોડાયેલ અંદાજ આપવામાં આવ્યો છે _____
[મિલકતના માલિકનું નામB]

પર સ્થિત મિલકત માટે _____
[મિલકતનું સરનામુંB]

ને આપવામાં આવેલો જોડાયેલ અંદાજ ઘરમાલિકને આપવામાં આવ્યો છે અને ઉપરોક્ત નામવાળી કંપની માટે માલિક અથવા અધિકૃત કર્મચારી તરીકે મારી સહી કરેલ છે.

હું પ્રમાણિત કરું છું કે મેં ક્લિફ્ટન હોમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ દ્વારા પ્રદાન કરેલ વર્કસાઇટ અને જોબ સ્પેસિફિકેશન્સ જોયા છે અને તમામ કામ જોબ સ્પેસિફિકેશન્સ અનુસાર કરવામાં આવશે. હું પ્રમાણિત કરું છું કે ઉપરોક્ત નિવેદનો મારી શ્રેષ્ઠ જાણ અને માન્યતા મુજબ સાચા અને સંપૂર્ણ છે. હું સમજું છું કે ખોટા નિવેદનો અથવા માહિતી ફેડરલ કાયદા હેઠળ સજાપાત્ર છે.

_____ [કોન્ટ્રાક્ટરની સહી]

_____ [તારીખ]

કોન્ટ્રાક્ટરો અને મકાનમાલિકોને નોટિસ

આ અંદાજ સબમિટ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા તમારા અંદાજ ભરેલ, સહી કરેલ અને જોડાયેલ

હોવું આવશ્યક છે. આ ફોર્મ વિના સબમિટ કરેલ કોઈપણ અંદાજને માન્ય અંદાજ ગણવામાં આવશે નહીં

અને ક્લિફ્ટન હોમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.

હું _____ આથી ના માલિક અથવા
[અંદાજ તૈયાર કરતી વ્યક્તિનું નામ] અહીં સહી સાથે અધિકૃત કર્મચારી તરીકે મારી સાથે

પ્રમાણિત કરું છું કે [મિલકતના માલિકનું નામ] _____
[અંદાજ ફોર્મ પર બતાવ્યા પ્રમાણે કંપનીનું નામ]

કે સાથે જોડાયેલ અંદાજ આપવામાં આવ્યો છે _____
[મિલકતના માલિકનું નામB]

પર સ્થિત મિલકત માટે _____
[મિલકતનું સરનામુંB]

ને આપવામાં આવેલો જોડાયેલ અંદાજ ઘરમાલિકને આપવામાં આવ્યો છે અને ઉપરોક્ત નામવાળી કંપની માટે માલિક અથવા અધિકૃત કર્મચારી તરીકે મારી સહી કરેલ છે.

હું પ્રમાણિત કરું છું કે મેં ક્લિફ્ટન હોમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ દ્વારા પ્રદાન કરેલ વર્કસાઇટ અને જોબ સ્પેસિફિકેશન્સ જોયા છે અને તમામ કામ જોબ સ્પેસિફિકેશન્સ અનુસાર કરવામાં આવશે. હું પ્રમાણિત કરું છું કે ઉપરોક્ત નિવેદનો મારી શ્રેષ્ઠ જાણ અને માન્યતા મુજબ સાચા અને સંપૂર્ણ છે. હું સમજું છું કે ખોટા નિવેદનો અથવા માહિતી ફેડરલ કાયદા હેઠળ સજાપાત્ર છે.

_____ [કોન્ટ્રાક્ટરની સહી]

_____ [તારીખ]